

Brief Note

‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)’

- ધોરણ ૯ થી ૧૨ શાળા કક્ષાના, કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ તથા અન્ય પ્રજાજન(૧૮ અને ૧૮ વર્ષથી ઉપરના) કેટેગરીમાં ગુજરાત રાજ્યના નાગરીકો ભાગ લઈ શકશે.
- કુલ ૪૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને પ્રજાજનો આ ક્વિઝમાં ભાગ લે તે પ્રમાણેનું આયોજન
- **ઈનામો રૂ.૨૫ કરોડથી વધુ અને વિજેતાઓને મળશે પ્રોત્સાહક રકમ/સ્ટડી ટ્રવર સ્વરૂપે આકર્ષક ઈનામો**
- પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા(કે જેમાં નગરપાલિકા સમાવિષ્ટ) અને વોર્ડ કક્ષાએ
- દ્વિતીય તબક્કામાં તાલુકા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઈન ક્વિઝ કરવામાં આવશે.
- ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝ યોજવામાં આવશે.
- www.g3q.co.in ડોમેઈન
- તા.૦૭ જુલાઈ, ૨૦૨૨ ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અને માન. મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ અને રજીસ્ટ્રેશન સંભવતઃ સમય : સાંજે ૦૪:૦૦ થી ૦૫:૪૫ (અંદાજે ૪૦૦૦ આમંત્રિતો)
- આ ક્વિઝમાં સામાન્ય સ્વરૂપે બહુ વૈકલ્પિક તથા ઓડિયો-વિડિયો સ્વરૂપની ક્વિઝ રહેશે.
- આ ક્વિઝમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલો, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન અને નોંધનીય બાબતોની ક્વિઝ રહેશે.
- આ ક્વિઝ વિદ્યાર્થીઓ માટે દરરોજ યોજાશે અને સતત ૭૫ દિવસ સુધી ચાલશે.
- આ ક્વિઝ અઠવાડિયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે.
- દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક ટીમ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો અને ક્વીઝમાં ૨૦ ક્વિઝ રહેશે.
- દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝિટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
- દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગનાં દસ-દસ વિજેતા તથા અન્ય પ્રજાજન કેટેગરીના ૨૦ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

તાલુકા અને વોર્ડ કક્ષાએ ક્વિઝ:

- શાળા કક્ષાના પ્રથમ વિજેતા ૨૧૦૦/- રૂપિયા, કોલેજ કક્ષાના પ્રથમ વિજેતા ૩૧૦૦/- રૂપિયા
- શાળા કક્ષાના દ્વિતીય વિજેતા ૧૫૦૦/- રૂપિયા, કોલેજ કક્ષાના દ્વિતીય વિજેતા ૨૧૦૦/- રૂપિયા

- શાળા કક્ષાના તૃતીય વિજેતા ૧૦૦૦/- રૂપિયા, કોલેજ કક્ષાના તૃતીય વિજેતા ૧૫૦૦/- રૂપિયા

વિશિષ્ટમાં તાલુકા કક્ષાએ ઈનામો :-

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ:

- પ્રથમ વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ, દ્વિતીય વિજેતાને રૂ.૭૫,૦૦૦ નું ઈનામ, તૃતીય વિજેતાને રૂ.૫૦,૦૦૦ નું ઈનામ આપવાના રહેશે.

કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામ:

- પ્રથમ વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નું ઈનામ, દ્વિતીય વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નું ઈનામ, તૃતીય વિજેતાને રૂ.૭૫,૦૦૦ નું ઈનામ આપવાના રહેશે.
- કુલ વિશિષ્ટ ઈનામ રૂ.૨૫,૦૦૦(શાળા કક્ષાએ) + ૪,૦૦,૦૦૦(કોલેજ કક્ષાએ)
- તાલુકા કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં સાયન્સ સિટી માટેની સ્ટડી ટુર ફી
- તમામ પ્રતિભાગીઓને (1+1) એમ ૦૨ વ્યક્તિઓને એક વર્ષના સમયગાળા દરમિયાન સાયન્સ સિટી માટેની ટુર ફી

વિશિષ્ટમાં તાલુકા કક્ષાએ અન્ય પ્રજાજન કેટેગરીના ઈનામો

- તાલુકા(કે જેમાં નગરપાલિકા સમાવિષ્ટ) અને વોર્ડ કક્ષાએ અન્ય પ્રજાજનોની કેટેગરી કક્ષાના ૭૫,૯૬૦ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળા દરમિયાન સાયન્સ સીટી, અમદાવાદ ખાતે ૦૧ દિવસ નિ:શુલ્ક સ્ટડી ટુર

જિલ્લા-મહાનગરપાલિકા કક્ષા:

- આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે. સંભવિત તા.૧૪/૦૮/૨૦૨૨
- જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા કુલ ૮૨૦ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે
- આ ૮૨૦ વિજેતાઓ બે દિવસના સાયન્સ સિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઈન્ડસ્ટ્રીઝની મુલાકાત એમ ઓન વાઈઝ સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત કરશે.
- અન્ય પ્રજાજનોની કેટેગરીના કુલ ૪૧૦૦ વિજેતાઓને બે દિવસની ઓન વાઈઝ ટુર(૨ દિવસ + ૦૧ રાત્રી) ઈનામ સ્વરૂપે આપવામાં આવશે.

આ ઉપરાંત વિશિષ્ટમાં જિલ્લા કક્ષાએ આકર્ષક ઈનામો :-

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ:

- પ્રથમ વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નું ઈનામ, દ્વિતીય વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦નું ઈનામ, તૃતીય વિજેતાને રૂ.૭૫,૦૦૦ના ઈનામ આપવાના રહેશે.

કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામ:

- પ્રથમ વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નું ઈનામ, દ્વિતીય વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નું ઈનામ, તૃતીય વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ આપવાના રહેશે.

રાજ્ય કક્ષાએ ક્વિઝ:

- જીલ્લા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ સંભવિત તા.૧૭/૦૯/૨૦૨૨ રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝ યોજવામાં આવશે.
- સમગ્ર સ્પર્ધા દરમિયાન જીલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો ભાગ લેવા માટે લાયક ઠરશે.
- આ સિવાયના અન્ય કોઈ વિદ્યાર્થી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.
- આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કુલ ૮૨૦ સ્પર્ધકો (૪૧૦ શાળા કક્ષાના + ૪૧૦ કોલેજ કક્ષાના) ભાગ લેશે.
- રાજ્ય કક્ષાની સ્પર્ધા ઓફલાઈન મોડમાં ક્વિઝ માસ્ટર સાથે કોઈ એક સ્થળે શાનદાર અને ધમાકેદાર રીતે આયોજીત થશે.
- રાજ્ય કક્ષાના ૧૫૦ વિજેતાઓને ત્રણ દિવસની ભારતના પ્રવાસી સ્થળો, યાત્રાધામો, ઉદ્યોગ ગૃહો અને ભારતની વિકાસગાથા દર્શાવતા સ્થળોની મુલાકાત કરાવવાની રહેશે.

વિશિષ્ટ સ્વરૂપે રાજ્ય કક્ષાએ આકર્ષક ઈનામો :-

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ:

- પ્રથમ વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નું ઈનામ, દ્વિતિય વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નું ઈનામ, તૃતિય વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ ના ઈનામ આપવાના રહેશે.

કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામ:

- પ્રથમ વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦ નું ઈનામ, દ્વિતિય વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નું ઈનામ, તૃતિય વિજેતાને રૂ.૧,૫૦,૦૦૦ ના ઈનામ આપવાના રહેશે.

અન્ય કક્ષાના પ્રતિભાગીઓ માટે :

- ક્વિઝની અન્ય કેટેગરીના આ ૭૫૦ વિજેતાઓ ત્રણ દિવસ(૦૩ દિવસ + ૦૨ રાત્રી)ની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથે ટુર (પતિ-પત્ની + ૨ બાળકો એમ કુલ ૦૪ અથવા તો કુટુંબના કોઈપણ ૦૪ સદસ્યો) ઈનામ સ્વરૂપે

- તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર લેવલે ડીજીટલ પ્રમાણપત્ર
- જે-તે શાળા કે કોલેજમાં સૌથી વધારે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા કે કોલેજને પ્રશસ્તિપત્ર, જે-તે તાલુકામાં વધુ ભાગ લેનાર સ્પર્ધકોની સંખ્યાને આધારે તાલુકા વિકાસ અધિકારીને પ્રશસ્તિપત્ર જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રીને, મ્યુનિસિપલ કક્ષાએ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને પ્રશસ્તિપત્ર, યુનિવર્સિટી કક્ષાએ કુલપતિશ્રીને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવશે